

Gokuliya Jevu Gir Song Lyrics

He... Hariyali gir ma mara nehda madhavji
He... Gandhi re gir ma mara nehda madhavji
Mal amare gayo vachharda thakarji

He... Vagh varu ne dipada re hoy dipada re
Gandi aa gir ne suna vagda thakarji
He... Gir na chhede mara nehda madhavji
He... Girodhare mara nehda madhavji

Ho... Akho di chariye ne hanje vale valiye
Rate uti ne ame mal ne hambhaliye
Akho di chariye ne hanje vale valiye
Rate uti ne ame mal ne hambhaliye

He... Prabhate pachha uti chhodiye re charva chhodiye re
Vachharda vala ma pachha valiye valamji
He... Vachharda vala ma pachha valiye valamji
He... Gheludi gir ma mara nehda madhavji

Ho... Nar tane netara ne gaje re valona
Nariyo vali chali thapi aave chhana
Ho... Nar tane netara ne gaje re valona
Bharatlyrics.com
Nariyo vali chali thapi aave chhana

He... Pankhiyo chare kor kare kal chhor ruda kare kal chhor
Gokuliya jevu maru gir re govindji
He... Gokuliya jevu maru gir re govindji
He... Girodhare mara nehda madavji

Ho... Deshi naliya vala ghar no aa neh chhe
Mayalo manvi ne mitha aena sneh chhe
Deshi naliya valo amaro aa neh chhe
Mayalu manvi ne mitho aeno sheh chhe

He jane mohal ma paromna re, vala paromna re
Manu ke mane aevu lagyu re thakarji
He... Manu ke mane aevu lagyu re thakarji
He... Manu ke mane aevu lagyu re thakarji

He... Gir na chhede mara nehda madhavji
He... Hariyali gir ma mara nehda madhavji.

More Lyrics from Zee Music Gujarati

ગોકુળીયા જૈવું ગીર Lyrics in Gujarati

હે... હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી
હે... ગાંડી રે ગીરમાં મારા નેહડા માધવજી
માલ અમારે ગાયો વાછરડા ઠાકરજી

હે... વાઘ વરુને હોય દીપડા રે, હોય દીપડા રે
ગાંડી આ ગીરને સુના વગડા ઠાકરજી
હે... ગીરના છેડે મારા નેહડા માધવજી
Bharatlyrics.com
હે... ગિરોધારે મારા નેહડા માધવજી

હો... આઓ દી ચારિયેને હાંજે વાળે વળીયે
રાતે ઉઠીને અમે માલને હુંભાળીયે
આઓ દી ચારિયેને હાંજે વાળે વળીયે
રાતે ઉઠીને અમે માલને હુંભાળીયે

હે... પ્રભાતે પાછા ઉઠી છોડીયે રે, ચરવા છોડીયે રે
વાછરડા વાડામાં પાછા વાળીયે વાલમજી
હે... વાછરડા વાડામાં પાછા વાળીયે વાલમજી
હે... ઘેલુડી ગીરમાં મારા નેહડા માધવજી

હો... નર તાણે નેતરાને ગાજે રે વલોણા
નારીયો વાળી ચાળી થાપી આવે છાણા
હો... નર તાણે નેતરાને ગાજે રે વલોણા
નારીયો વાળી ચાળી થાપી આવે છાણા

હે... પંખીયો ચારે ક્રોર કરે કલ છોર, રુડા કરે કલ છોર
ગોકુળીયા જૈવું મારું ગીર રે ગોવિંદજી
હે... ગોકુળીયા જૈવું મારું ગીર રે ગોવિંદજી
હે... ગિરોધારે મારા નેહડા માધવજી

હો... દેશી નળીયા વાળા ઘરનો આ નેહ છે
માયાળો માનવીને મીઠા એના સનેહ છે
દેશી નળીયા વાળો અમારો આ નેહ છે
માયાળું માનવીને મીઠો એનો સનેહ છે

હે જાણો મોહાળમાં પરોમણા રે, વાલા પરોમણા રે
મનુ ક્રે મને એવું લાગ્યું રે ઠાકરજી
હે... મનુ ક્રે મને એવું લાગ્યું રે ઠાકરજી

હે... મનુ ક્રે મને એવું લાગ્યું રે ઠાકરજી

હે... ગીરના છેડે મારા નેહડા માધવજી

હે... હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી.

More Lyrics from [Zee Music Gujarati](#)

BHARAT
lyrics